

રાજકોટ મહાનગરપાલિકા
રોશની વિભાગ - જાહેર નિવેદા

રાજકોટ મહાનગરપાલિકા માટે અલગ અલગ ઇલેક્ટ્રીક તથા ગેસ આધારીત સ્મશાનોને વાર્ષિક ધોરણે મેઇન્ટેનન્સ કરવાનું હોઈ આ કામ માટે રસ ધરાવતી તથા આ પ્રકારના કામોનો પુર્વ અનુભવ ધરાવતી એજન્સીઓ પાસેથી ઈ- ટેન્ડર પદ્ધતિથી ભાવો મંગાવવામાં આવે છે.

- ૧) કામની અંદાજીત રકમ (વાર્ષિક): રૂ. ૨૧,૦૦,૦૦૦/-
- ૨) ઈ.એમ.ડી. ની રકમ: રૂ. ૨૧,૦૦૦ /-
- ૩) ટેન્ડર ફી ની રકમ: રૂ. ૧,૧૨૫/- (નોન રીફંડેબલ)

ઈ-ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ	તા.૦૧-૦૬-૨૦૧૯ થી તા.૨૨-૦૬-૨૦૧૯ સાંજનાં ૧૮.૦૦ કલાક સુધી
ઈ ટેન્ડર-ઓન-લાઈન સબમિટ કરવાની છેલ્લી તારીખ	તા.૨૨-૦૬-૨૦૧૯ સાંજનાં ૧૮.૦૦ કલાક સુધી
ટેકનીકલ બીડ સબમીટ કરવાની તારીખ	તા.૨૬-૦૬-૨૦૧૯, સમય સાંજનાં ૧૮.૦૦ કલાકે સુધી
ટેકનીકલ બીડ ખોલવાની તથા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવાની તારીખ (અંદાજીત)	તા.૨૭-૦૬-૨૦૧૯ સમય ૧૮.૦૦ કલાકે
ઓન-લાઈન પ્રાઈસ બીડ ખોલવાની તારીખ (અંદાજીત)	તા.૨૮-૦૬-૨૦૧૯ સમય ૧૧.૦૦ કલાકે
ટેન્ડર વેલીડીટી પિરિયડ	૧૮૦ દિવસ

વધુ માહિતી માટે <https://rnc.nprocure.com> ની વેબસાઈટ પરથી વિગત મેળવવી.

૧. એજન્સીએ છેલ્લા સાત નાણાકીય વર્ષ દરમ્યાન ઇલે/મીકે. મેઇન્ટેનન્સ ના કામ કોઇપણ સરકારી કે અર્ધ સરકારી ખાતામાં પૂર્ણ કરેલ હોવું જોઈએ. જે અંગેના જરૂરી દસ્તાવેજો, વર્ક કમ્પ્લીશન સર્ટીફિકેટ ટેકનીકલ બીડ સાથે જોડવાના રહેશે.
૨. એજન્સીનું છેલ્લા સાત નાણાકીય વર્ષનું સરેરાશ વાર્ષિક ટર્ન ઓવર રૂ. ૧૦.૫૦ લાખથી વધુ હોવું જોઈએ. જે અંગે CA દ્વારા પ્રમાણીત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. ટર્ન ઓવર માટે રાજકોટ મહાનગરપાલિકાનાં નિયમાનુસાર Enhance Factor લાગુ પાડવામાં આવશે.
૩. આ કામે ઈ.એમ.ડી. તેમજ ટેન્ડર ફી નાં ડિમાન્ડ ડ્રાફ્ટ રાજકોટ મહાનગરપાલિકા ની તરફેણમાં (નેશનલાઈઝડ અથવા શેડયુલ બેન્ક) ટેકનીકલ બીડ સાથે બીડવાનો રહેશે.
- ૪ એજન્સી I UV" નંબર ધરાવતી હોવી જોઈએ.

- ૫ એજન્સી RH**Rtqxk gpvHwpf #રજીસ્ટ્રેશન નંબર ધરાવતી હોવી જોઈએ.
- ૬ એજન્સી માન્ય ઇલેક્ટ્રીકલ કોન્ટ્રાક્ટર લાયસન્સ ધરાવતી હોવી જોઈએ.
૭. એજન્સીએ રૂા. ૨ લાખ કે તેથી વધુનું નેશનલાઈઝડ કે શેડયુલ બેન્કનું તાજુ (ટેન્ડરની તારીખથી એક વર્ષ જુનુ ન હોય તેવું) સોલ્વન્સી સર્ટીફિકેટ આપવાનું રહેશે.
૮. આ કામ માટે કોઈ પણ પ્રકારનું જોઈન્ટ વેન્યર માન્ય રાખવામાં આવશે નહિ.
૯. એજન્સીએ જરૂરી પાન (PAN) નંબર આપવાનો રહેશે.
૧૦. શરતી ટેન્ડર માન્ય રાખવામાં આવશે નહી.
૧૧. આ કામ માટે એજન્સી કોઈ પેટા કોન્ટ્રાક્ટ કરી શકશે નહી કે રાખી શકશે નહી.
૧૨. જે એજન્સીના ભાવ મંજુર થાય તેમણે નિયમ મુજબનું સ્ટેમ્પ પેપર પર કરારનામુ કરી સીકયોરીટી ડીપોઝીટ મંજુર થયેલ રકમના ૫% ના ધોરણે એફ.ડી.આર. અથવા બેન્ક ગેરન્ટી ૧૮ માસ માટે “રાજકોટ મહાનગરપાલિકા” ની તરફેણમાં (નેશનલાઈઝડ અથવા શેડયુલ બેન્ક) આપવાની રહેશે એફ.ડી.આર.ના કિસ્સામાં સરકારશ્રીના નિયમાનુસાર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. સીકયોરીટી ડીપોઝીટ ભરવામાં નીષ્ફળ જશે તો ઇ.એમ.ડી જપ્ત કરવામાં આવશે અને નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
૧૩. ટેકનીકલ બીડ કવર પર “રાજકોટ મહાનગરપાલિકાનાં અલગ અલગ ઇલેક્ટ્રીક તથા ગેસ આધારીત સ્મશાનોને વાર્ષિક ધોરણે મેઇન્ટેનન્સ કરવાનું કામ.” તેમ લખવું તેમજ ટેકનીકલ બીડ ડોક્યુમેન્ટનું કવર સમયમર્યાદામાં નીચેના સરનામે સ્પીડ પોસ્ટથી/કુરીયરથી/રૂબરૂ પહોચાડવાનું રહેશે.

પ્રતિ,
 એડી.સીટી એન્જીનીયર
 રાજકોટ મહાનગરપાલિકા
 રોશની વિભાગ, પુર્વ ઝોન
 શ્રી ઝવેરચંદ મેઘાણી ભવન, રૂમ નં ૨,
 રાજમોતી ઓઇલમીલ સામે
 ભાવનગર રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫

૧૪. ડોક્યુમેન્ટસના તથા ટેન્ડરના દરેક પેઇઝ પર એજન્સીએ સહી સિક્કા કરવાના રહેશે.

૧૫. જે એજન્સી ટેકનીકલ બીડમાં ક્વોલીફાય થશે તેનાં જ પ્રાઈસ બીડ ખોલવામાં આવશે.
૧૬. આ કામે ભાવો (ઓફર) ફક્ત ઓનલાઈન જ ભરવાનાં છે.
૧૭. આ ટેન્ડર સંબંધિત કોઈ પણ વિવાદ ઉપસ્થિત થશે તો તે ફક્ત રાજકોટ જ્યુરીડિક્શન પુરતો મર્યાદિત રહેશે. આ કામે ન્યાયનું ક્ષેત્ર રાજકોટ જ રહેશે.
૧૮. આવેલ કોઈ પણ ભાવ સ્વીકારવાનો કે તમામ ભાવ રદ કરવાનો અધિકાર અબાધીત રાખવામાં આવે છે.
૧૯. એજન્સીએ સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં ક્યારેય બ્લેક લીસ્ટ થયેલ નથી તેવું રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ્ડ ઓરીજનલ સોગંદનામું રજુ કરવાનું રહેશે.

એડી.સીટી એન્જનીયર
રોશની વિભાગ
રાજકોટ મહાનગરપાલિકા